

12 એપ્રિલ 2018

**સીટી સૌપ્રથમ વખત બ્રેમ્પટનમાં યોજે છે રમતગમત દિન  
એપ્રિલ 21ના રોજ નવી રમતગમતને મફત અજમાવી જોવા મુલાકાત લો**

બ્રેમ્પટન, ON – એપ્રિલ 21ના રોજ સીટીના સહુ પ્રથમ એવા બ્રેમ્પટન ખાતેના રમતગમત દિન એટલેકે સ્પોર્ટ્સ ડેમાં નિવાસીઓને પોતાના સમુદાયમાં રમતગમત વિશે જાણકારી મેળવવા માટે આમંત્રિત કરવામાં આવે છે.

બ્રેમ્પટન સોકર સેન્ટર અને કેસિ કૅમ્પબેલ કમ્યુનિટી સેન્ટર પર અજમાવી જોવા માટેની મફત મુલાકાતોમાં સવારે 10 અને સાંજે 4 વાગ્યા વચ્ચે નવી રમત અજમાવી જુઓ. એમાં સામેલ રમતગમત છે બેઝબોલ, લેકોસ, સોકર, ટ્રેક, ફુટબોલ, માર્શ્યલ આર્ટ, જિમ્નેસ્ટિક્સ, વ્હીલચેર બાસ્કેટબોલ, હૉકી, સ્વિમિંગ અને બીજું ઘણું.

કાર્યક્રમોનું સમયપત્રક સીટી અને સંબંધિત યુથ સ્પોર્ટ્સ ઓર્ગનાઈઝેશનો, બ્રેમ્પટન સ્પોર્ટ અલાયન્સ અન્ય કમ્યુનિટી સ્પોર્ટ પ્રોવાઈડર્સ સાથે પૂરા પાડે છે. અમારા નાના રમતગમતનાં જૂથો સાથે સંપર્ક સાધવા, તેમના કાર્યક્રમો વિશે વધુ જાણકારી મેળવવા અને શહેર ફરતે ઉપલબ્ધ બહોળા વૈવિધ્ય ધરાવતી પ્રવૃત્તિઓ માટે પરિવારોને આમંત્રિત કરવામાં આવે છે. ઈનામ જીતવાની તક માટે ઈવેન્ટ પાસપોર્ટ પર ત્રણ સ્ટેમ્પ્સ મેળવો!

ઈવેન્ટનાં સંપૂર્ણ સમયપત્રક માટે અહીં મુલાકાત લો [www.brampton.ca](http://www.brampton.ca)

**રસપ્રદ હકિકતો:**

- બ્રેમ્પટનમાં આ બંધું છે: 233+ મેદાનની/ઈન્ડોર રમતગમતના ફિલ્ડ, 36 આનંદપ્રમોદની સવલતો, 18 આઈસ પેડ, 13 તરણ કુંડ, 7 ફિટનેસ સેન્ટરો, 4 આઉટડોર સ્કેટિંગ રિંક્સ, 1 9-હોલ સાર્વજનિક ગોલ્ફ કોર્સ, અને 1 સ્કિ હિલ
- સીટીના ત્રણ ટોચના રજિસ્ટ્રેશનો છે: સ્વિમિંગ, કેમ્પ્સ અને સ્કેટિંગ
- શહેરમાં 20,000 સહભાગીઓ સાથેના 21 યુથ સ્પોર્ટ્સ સંબંધિત જૂથો છે અને 80 પુખ્ત કમ્યુનિટી જૂથો છે

**કવોટ:**

બ્રેમ્પટન પાસે રમતગમતનો સમૃદ્ધ ઇતિહાસ છે, જેને કારણે ઉત્કૃષ્ટ રમતવીરો અને રમતગમતના સમર્પિત ચાહકો ઊભા થયા છે. આનંદ માટે, મિત્રો બનાવવા અને સક્રિય નિરોગી જીવન શૈલી જાળવવા માટે રમતો રમવી સારામાં સારી રીત છે. બ્રેમ્પટન ખાતેનો સ્પોર્ટ્સ દિન યુવાન લોકોને વિવિધ વિકલ્પો તપાસવા અને પોતે માણી શકે એવી રમત શોધવાની જોરદાર તક આપે છે.

- મેયર લિન્ડા જેફી

-30-

બ્રામ્પટનમાં મોટા પાયે ફેરફારો થઈ રહ્યાં છે. આપણે વેધક ધ્યાન કેન્દ્રિત કરતા ભવિષ્ય માટે તૈયાર સંસ્થા છીએ. આપણે આપણાં સમુદાયની વૃદ્ધિ જાણીએ છીએ, જુવાની અને વિવિધતા આપણને અલગ અલગ કરે છે. આપણે કેનેડાના નવીન શોધ કરતા સુપર કોરિડોરના કેન્દ્રમાં સ્થિત, રોકાણ પ્રોત્સાહક અને આપણી વૈશ્વિક સફળતા વિકસાવનાર છીએ. આપણે ગુંજી ઊઠતા શહેરી કેન્દ્રો વિકસાવીએ છીએ જે ધૂજતા નથી અને અહીં રહેતા અને કાર્યરત લોકોમાં ગૌરવ વધારીએ છીએ. આપણે બ્રામ્પટનને આગળ વધારી રહ્યાં છીએ જે તેને નવીનતમ, સર્વગ્રાહી અને જુસ્સામય શહેર બનાવે. અમને [Twitter](#) અને [Facebook](#) પર અનુસરો. [www.brampton.ca](http://www.brampton.ca) પર વધુ માહિતી જાણો.

**મીડિયા સંપર્ક (MEDIA CONTACT)**

નાટાલી સ્ટોગડિલ (Natalie Stogdill)

મીડિયા કોર્ડિનેટર (Media Coordinator)

સીટી ઓફ બ્રામ્પટન (City of Brampton)

905.874.3654 | [natalie.stogdill@brampton.ca](mailto:natalie.stogdill@brampton.ca)